

રવિ મિસ્ત્રીની IIT ગાંધીનગર ડિરે.તરીકે નિમણૂક

અમદાવાદ | અમેરિકા સ્થિત ચેરિટેબલ ટ્રસ્ટ આઇઆઇટી ગાંધીનગર ફાઉન્ડેશનના પ્રથમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રવિ મિસ્ત્રીની નિમણૂક કરવામાં આવી છે. રવિ મિસ્ત્રી દાતાઓ અને આઇઆઇટી ગાંધીનગર વચ્ચે સેતુની ભૂમિકા ભજવશે. આઇઆઇટી ગાંધીનગરના ડિરેક્ટર ડો.સુધીર જૈને રવિ મિસ્ત્રીની નિમણૂકને આવકારતા જણાવ્યું છે કે તેમની નિમણૂકથી અમારી સંસ્થાને ઘણો લાભ થશે. મિસ્ત્રીએ જણાવ્યું છે કે ભારતમાં ટેકનોલોજી એપ્લિકેશનમાં સુધારો કરવા હું બહુ આતુર છું.